



ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચ સિદ્ધી અને નિમ્ન સિદ્ધી ધરાવતા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના લક્ષણોનો કેટલાંક ચલોના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ

ડૉ. મેહાલી આર. દેસાઈ

આસી. પ્રોફેસર

શ્રી શંકર બી. એડ્. કોલેજ, માણુંદ

૧. પ્રસ્તાવના

પ્રવર્તમાન સમયમાં દરેક મા-બાળની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક શાળાકીય પરિણામોમાં ઉચ્ચ સિદ્ધી મેળવે. એ જ રીતે દરેક શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ માટે આવું જ ઈચ્છતા હોય છે. એ સ્વભાવિક છે. પણ અહીં એવું માનવું ભૂલ ભરેલું છે કે મા શાળાકીય પરિણામોમાં ઉચ્ચ સિદ્ધી મેળવનાર વિદ્યાર્થીઓ જ પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં અથવા અન્ય ક્ષેત્રમાં આગળ હોય અને શાળાકીય પરિણામોમાં નિમ્ન સિદ્ધી મેળવનાર વિદ્યાર્થીઓ આવા ક્ષેત્રમાં પાછળ હોય. ૧૯૯૪ માં નિમાયેલ કિઠારી કમિશને જાગ્રાવ્યું છે કે,

“મારતનું ભાવિ તેના વર્ગિંડોમાં ઘડાઈ રહ્યું છે.”

આપણે દેખીતી રીતે જ જોઈ શકીએ છીએ કે શિક્ષક પોતાના વર્ગિંડમાં દરેક બાળકને એક સરખી અધ્યાપન પદ્ધતિ વડે અધ્યયન કાર્ય કરાવે છે. દરેકને એક સરખું ભૌતિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, છતાં શિક્ષક જ્યારે પોતાનું અધ્યાપન કાર્ય કેટલું સરળ થયું તે જાગ્રવા માટે મૂલ્યાંકન કરે છે ત્યારે જોઈ શકે છે કે કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ સિદ્ધી પ્રાપ્ત કરે છે, તો કેટલાક નિમ્ન સિદ્ધી પ્રાપ્ત કરતા જોવા મળે છે.

આથી જો શિક્ષક બાળકની સિદ્ધી અને તેના વ્યક્તિત્વ લક્ષણોથી પરિચિત થાય અને મા સિદ્ધી જ નહીં પરંતુ તેના વ્યક્તિત્વમાં રહેલી અભિરૂચિના આધારે તેની રસ, રૂચિ પ્રમાણો, ચિકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, જીવા ગુણોને ધ્યાનમાં લઈ બાળકનું સારું અને યોગ્ય દિશામાં ઘડતર કરવામાં આવે તો શિક્ષક તેના શૈક્ષણિક કાર્યમાં સાર્થક અને સરળ બની શકે.

૨. શીર્ષક

પ્રસ્તુત સંશોધનનું શીર્ષક આ પ્રમાણો રાખવામાં આવેલ છે. જેમાં,

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચ સિદ્ધી અને નિમ્ન સિદ્ધી ધરાવતા વિદ્યાર્થીઓનાં વ્યક્તિત્વનાં લક્ષણોનો કેટલાક ચલોના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ

૩. અભ્યાસના હેતુઓ

સંશોધકે આ પ્રમાણોના હેતુઓ નક્કી કરેલ છે જેમાં,

- ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધી ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધી ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓનાં ‘વ્યક્તિગત પસંદગી’ પાક’નાં સરાસરી પ્રાપ્તાંકી વર્ણણેની તુલના કરવી.
- ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધી ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધી ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓનાં ‘વ્યક્તિગત પસંદગી’ પાક’નાં સરાસરી પ્રાપ્તાંકી વર્ણણેની તુલના કરવી.

૪. ઉત્કૃષ્ણનાઓ

સંશોધક પોતાના સંશોધનમાં ઉત્કૃષ્ણનાઓ આ પ્રમાણો નક્કી કરેલ છે જેમાં,

Ho₁ ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓનાં 'વ્યક્તિગત પસંદગી પ ક'માં લક્ષણવાર મેળવેલ સરાસરી પ્રાપ્તાંકી વચ્ચે સાર્થક તર્ફાવત નહીં હોય.

Ho₂ ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓનાં 'વ્યક્તિગત પસંદગી પ ક'માં લક્ષણવાર મેળવેલ સરાસરી પ્રાપ્તાંકી વચ્ચે સાર્થક તર્ફાવત નહીં હોય.

૫. સંશોધનનું કોષ્ટ

સંશોધકે પ્રસ્તુત સંશોધન માટે સંતરામપુર તાલુકામાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધિ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના વ્યક્તિગત લક્ષણોનો કેટલાક ચલોના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ કરવાનો હોવાયી આ અભ્યાસ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણક્ષેત્ર તરીકે લેવામાં આવ્યો છે.

૬. અભ્યાસનું મહત્વ

શૈક્ષણિક સંશોધન એ શિક્ષણ સુધારણા માટે આશીર્વાદરૂપ છે. શિક્ષણ એ જીવંત પ્રક્રિયા છે અને તેમાં સમયે અમ્યે પરિવર્તનની આવશ્યકતા રહે છે. આવા પરિવર્તનને વધુ નક્કર બનાવવા સંશોધનની આવશ્યકતા રહેલી છે. સંશોધક દ્વારા હાથ ધરવામાં આવતું સંશોધન જો વિદ્યાર્થીઓ, શિક્ષકો કે સમાજ માટે ઉપયોગી બને તો જ તે સંશોધન સાર્થક ગણી શકાય. પ્રસ્તુત સંશોધનનું મહત્વ આ મુજબ છે જેમાં,

- પ્રસ્તુત અભ્યાસમાં 'વિદ્યાર્થીઓની સિદ્ધિ અને તેના વ્યક્તિગત લક્ષણોને આધારે તુલના કરવામાં આવી છે. ઉચ્ચ સિદ્ધિવાળા વિદ્યાર્થી કેવા વ્યક્તિગત લક્ષણો ધરાવે છે. કયા લક્ષણો બન્નેમાં સમાન જોવા મળે છે અને કયા લક્ષણો બન્નેમાં પરસ્પર વિરોધી રીતે જોવા મળે છે તેનો અભ્યાસ ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ના 'વિદ્યાર્થીઓને આધારે કરવામાં આવે છે.
- આમ, વ્યક્તિગત લક્ષણોનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. ઇજુ આપણી શિક્ષણપ્રથમામાં આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવતી નથી અને તેથી જ ઉપરોક્ત બાબતોમાં જોવા મળે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં, ફેશન ક્ષેત્રમાં કે એટમબોબના ક્ષેત્રમાં જેટલી સમાનતા બાળકોના વ્યક્તિગત લક્ષણો જાળવામાં નથી. જો આ બાબતને આપણે અંગૂઠી નિર્દેશ તરીકે સ્વીકારીએ તો પ્રસ્તુત અભ્યાસનું મહત્વ ઉપરોક્ત વાક્યામાં જ સમાઈ જાય છે અને તેથી જ પ્રસ્તુત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

૭. વિદ્યાર્થીઓની સિદ્ધિ, જાતિ અને કક્ષાના આધારે વ્યક્તિગત લક્ષણોની તુલના

૭.૧ ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓનાં 'વ્યક્તિગત પસંદગી પ ક'માં લક્ષણવાર મેળવેલ સરાસરી પ્રાપ્તાંકી વચ્ચે સાર્થક તર્ફાવત નહીં હોય.

સારણી ૧-ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના વ્યક્તિગતના લક્ષણોની સરાસરી પ્રમાણીત વિચલન અને કાંતિક ગુણોત્તર

ક્રમ	ચલ	ધોરણ-૧૧ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ N ₁ =105	ધોરણ-૧૧ નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ N ₂ =93		સરાસરી નો તર્ફાવત	પ્રમાણ ભૂલ	કાંતિક ગુણોત્તર	સાર્થકતા		
			સરાસરી	પ. વિ.	સરાસરી	પ. વિ.	M ₁ - M ₂	σ D	t	
૧	સિદ્ધિ	૩૪.૭૫	૬.૬૫	૩૪.૩૮	૬.૪૩	૧.૩૬	૦.૮૫૧	૧.૪૩	N.S.	
૨	આદર કરવો	૩૬.૦૪	૭.૬૪	૩૭.૫૮	૭.૪૮	૧.૫૪	૧.૦૫૭	૧.૪૧	N.S.	
૩	વ્યવસ્થા	૩૫.૮૬	૮.૮	૩૭.૨૫	૭.૭૩	૧.૨૮	૧.૧૩૮	૧.૧૩	N.S.	
૪	પ્રદર્શન	૩૧.૨૨	૬.૨૬	૩૧.૫૮	૫.૮૪	૦.૩૬	૦.૮૬૮	૦.૪૧	N.S.	
૫	સ્વાચ્છતા	૩૩.૦૨	૫.૫૮	૩૨.૫૫	૬.૫૩	૦.૪૭	૦.૮૭	૦.૪૪	N.S.	
૬	સંલગ્નતા	૩૫.૫૫	૭.૩૧	૩૫.૦૧	૬.૮૪	૨.૮૪	૧.૦૦૬	૨.૮૩	**	

૭	આંતરિક સમજ	૩૨.૬	૬.૫૨	૩૨.૭	૮.૦૪	૨.૮૪	૧.૦૪૮	૨.૭૧	**
૮	મદદ	૩૩.૫૫	૭.૫	૩૫.૪	૭.૭૯	૧.૮૨	૧.૦૯	૧.૬૭	N.S.
૯	પ્રમુખ્ય	૩૧.૭૬	૭.૨	૩૨.૧૩	૬.૦૪	૧.૬૩	૦.૬૪૨	૧.૭૩	N.S.
૧૦	અવમાન	૩૨.૮૬	૬.૩૩	૩૩.૩૯	૬.૮૧	૧.૦૯	૦.૬૩૮	૧.૧૬	N.S.
૧૧	બીજાઓની કાળજી લેવી	૩૫.૧૬	૬.૬૩	૩૩.૬૪	૭.૩૭	૧.૩૪	૧.૦૦૧	૧.૩૪	N.S.
૧૨	પરિવર્તન	૩૪.૪	૬.૬૪	૩૬.૪૧	૬.૭૧	૧.૨૩	૦.૬૫૧	૧.૨૯	N.S.
૧૩	સહનશીલતા	૩૬.૨૩	૭.૧૪	૩૫.૬૩	૬.૪૫	૦.૬	૦.૫૬૬	૦.૬૨	N.S.
૧૪	વિજ્ઞાતિય કામવૃત્તિ	૩૨	૬.૧૮	૩૧.૪૭	૬.૧	૦.૫૩	૦.૮૭૪	૦.૬૦	N.S.
૧૫	આકમકતા	૩૨.૪૩	૫.૪૮	૩૩.૭૬	૬.૧૧	૧.૩૩	૦.૮૩	૧.૬૦	N.S.

N.S. – Not Significant *0.05 કક્ષાએ સાર્થક **0.01 કક્ષાએ સાર્થક

સારણી ૧ ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થી અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ લક્ષણોની સરાસરી, પ્રમાણિત વિચલન અને કાંતિક ગુણોત્તર દર્શાવે છે. સારણી પરથી જુદા જુદા ૧૫ વ્યક્તિત્વ લક્ષણોમાંથી વ્યક્તિત્વ લક્ષણ સિદ્ધિ, આદર કરવો, વ્યવસ્થા, પ્રદર્શન, સ્વાયત્તતા, મદદ, પ્રમુખ્ય, અવમાન, બીજાઓની કાળજી લેવી, કામવૃત્તિ અને આકમકતા. જોવા લક્ષણોમાં ઉચ્ચ સિદ્ધિ ધરાવતા ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓમાં કોઈ તફાવત જોવા મળતો નથી. આથી આ લક્ષણો માટે શુન્ય ઉત્કલ્યના H_{01} નો સિવકાર થાય છે. આથી કહી શકાય કે વ્યક્તિત્વ લક્ષણ, સિદ્ધિ, આદર કરવો, વ્યવસ્થા, પ્રદર્શન, સ્વાયત્તતા, મદદ, પ્રમુખ્ય, અવમાન, બીજાઓની કાળજી લેવી, પરિવર્તન, સહનશીલતા વિજ્ઞાતિય કામવૃત્તિ અને આકમકતા જોવા લક્ષણો માટે ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ એકબીજથી ભિન્નની ધરાવતા નથી.

પરંતુ વ્યક્તિત્વ લક્ષણ સલગ્નતા, અને આંતરિક સમજ માટે મૂલ્ય અનુક્રમે ૨.૮૩ અને ૨.૭૦ કરતા વધારે હોવાયી ૦.૦૧ કક્ષાએ સાર્થક છે. આથી વ્યક્તિત્વ લક્ષણ સલગ્નતા અને આંતરિક સમજ માટે ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓમાં ભિન્નની જોવા મળે છે. વ્યક્તિત્વ લક્ષણ સંલગ્નતા અને આંતરિક સમજ માટે સારણી ૧ પરથી સ્પષ્ટ થાય છે કે ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં નિમ્ન સિદ્ધિ ધરાવતાં વિદ્યાર્થીઓની સરાસરી ઓછી છે. તેથી નિમ્ન સિદ્ધિ ધરાવતાં વિદ્યાર્થીઓ સંલગ્નતામાં અને આંતરિક સમજ નીચી જોવા મળે છે.

આમ છતા તેમની સરાસરી વર્ચ્યે જે કોઈ તફાવત જોવા મળે છે તે આકિસ્મક છે. અને આ વિદ્યાર્થીઓની સરાસરી વર્ચ્યે જે તફાવત જોવા મળે છે તે ૮૫ % વિશ્વાસ સાથે કહી શકાય.

આમ, ઉપરોક્ત બાબતો પરથી જુણાય છે કે ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ સલગ્નતા અને આંતરિક સમજ કેળવવામાં ચઢિયાતા છે.

૭.૨ ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા (સમગ્ર) વિદ્યાર્થીઓનાં ‘વ્યક્તિગત પસંદગી પાઠક’માં લક્ષણવાર મેળવેલ સરાસરી પ્રાપ્તાંકી વર્ચ્યે સાર્થક તફાવત નહીં હોય.

સારણી ૨-ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના લક્ષણોની સરાસરી પ્રમાણીત વિચલન અને કાંતિક ગુણોત્તર

ક્રમ	ચલ	ધોરણ-૧૨ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ N ₁ =88	ધોરણ-૧૨ નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ N ₂ =79			પ્રમાણ ભૂલ	કાંતિક ગુણોત્તર	સાર્થકતા	
		સરાસરી	પ.વિ.	સરાસરી	પ.વિ.	M ₁ - M ₂	σ D		
૧	સિદ્ધિ	૩૭.૨૨	૬.૮૩	૩૭.૦૮	૬.૨૪	૦.૧૪	૧.૦૧૬	૦.૧૪	N.S.
૨	આદર કરવો	૩૭.૪૨	૭.૪૫	૪૦.૬૩	૮.૨૫	-૩.૨૧	૧.૨૧૫	૨.૬૪	**
૩	વ્યવસ્થા	૪૨.૩૪	૬.૫૩	૪૧.૭૮	૫.૭૭	૦.૫૬	૦.૮૫૮	૦.૫૮	N.S.
૪	પ્રદર્શન	૩૨.૮૫	૬.૪૮	૩૩.૭૫	૬.૫૧	-૦.૮	૧.૦૦૭	૦.૮૮	N.S.
૫	સ્વાયત્તતા	૩૩.૩૨	૬.૨૭	૩૩.૭૫	૬.૫૮	-૦.૪૩	૦.૬૬૫	૦.૪૩	N.S.
૬	સંલગ્નતા	૩૭.૮૬	૭.૪૪	૩૭.૮	૬.૭૪	૩.૪૬	૧.૧૦૩	૩.૧૪	**
૭	આંતરિક સમજ	૩૪.૩૩	૭.૩૩	૩૪.૪	૭.૪૭	-૩.૨૪	૧.૧૫૪	૨.૧૮	*
૮	મદદ	૩૬.૪૬	૮.૮૧	૩૭.૫૭	૮.૪૮	૨.૧૦	૧.૩૪૧	૧.૫૫	N.S.
૯	પ્રભૂત્વ	૩૨.૪૨	૬.૮	૩૪.૩૬	૬.૭૨	-૩.૪૮	૧.૦૪૮	૩.૩૨	**
૧૦	અવમાન	૩૫.૨૨	૬.૮૩	૩૫.૮	૬.૪૬	-૨.૬૪	૧.૦૪	૨.૫૪	**
૧૧	બીજાઓની કાળજી લેવી	૩૭.૮૩	૭.૭૮	૩૭.૮૬	૭.૪૬	૦.૨૫	૧.૧૮૩	૦.૨૧	N.S.
૧૨	પરિવર્તન	૩૭.૭૨	૫.૮૧	૩૭.૨૮	૬.૫૭	-૨.૨૫	૦.૬૬૭	૨.૨૮	*
૧૩	સહનશીલતા	૩૭.૮	૬.૮૧	૩૮.૬૭	૬.૧૬	-૨.૦૭	૧.૦૦૮	૨.૦૫	*
૧૪	વિજ્ઞતિય કામવૃત્તિ	૩૩.૦૮	૭.૬	૩૩.૧૫	૬.૭૮	-૦.૦૬	૧.૧૨	૦.૦૫	N.S.
૧૫	આકમકતા	૩૪.૬૭	૬.૧૫	૩૪.૧૮	૬.૭૮	૦.૪૮	૧.૦૦૧	૦.૪૮	N.S.

N.S. – Not Significant

*0.05 કક્ષાએ સાર્થક

**0.01 કક્ષાએ સાર્થક

સારણી ૨ ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ લક્ષણોની સરાસરી, પ્રમાણીત વિચલન અને કાંતિક ગુણોત્તર દર્શાવે છે. સારણી પરથી જુદા જુદા ૧૫ વ્યક્તિત્વ લક્ષણોમાંથી વ્યક્તિત્વ લક્ષણોની માહિતી મળે છે.

અહીં સારણી જોતા વ્યક્તિત્વ લક્ષણના જુદા જુદા ૧૫ વ્યક્તિત્વ લક્ષણોમાંથી વ્યક્તિત્વ લક્ષણ સિદ્ધિ, વ્યવસ્થા, પ્રદર્શન, સ્વાયત્તતા, બીજાઓની કાળજી લેવી, વિજ્ઞતિય કામવૃત્તિ અને આકમકતા જેવા લક્ષણોમાં ઉચ્ચ સિદ્ધિ ધરાવતા ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓમાં કોઈ સાર્થક તરફાવત જોવા મળતો નથી. આથી આ લક્ષણો માટે શૂન્ય ઉત્કલ્યના H₀₂ નો સિવિકાર થાય છે. આથી કહી શકાય કે વ્યક્તિત્વ લક્ષણ સિદ્ધિ, વ્યવસ્થા, પ્રદર્શન, સ્વાયત્તતા, બીજાઓની કાળજી લેવી, વિજ્ઞતિય કામવૃત્તિ અને આકમકતા માટે ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ એકબીજથી બિનન્તા ધરાવતા નથી.

પરંતુ વ્યક્તિત્વ લક્ષણો આંતરિક સમજ, અવમાન, પરિવર્તન અને સહનશીલતા માટે t નું મૂલ્ય અનુક્રમે ૨, ૧૮, ૨, ૫૪, ૨, ૨૮ અને ૨.૦૫ છે. જે ૧.૬૯ કરતાં વધારે છે. આથી આ વ્યક્તિત્વ લક્ષણો ૦.૦૫ કક્ષાએ સાર્થક છે. પરિણામે વ્યક્તિત્વ લક્ષણો આંતરિક સમજ, અવમાન, પરિવર્તન અને સહનશીલતા માટે શૂન્ય ઉત્કલ્યના H₀₂ નો અસિવિકાર કરવામાં આવે છે. વળી વ્યક્તિત્વ લક્ષણો આદર કરવો, સહનશીલતા અને પ્રભૂત્વ માટે t નું મૂલ્ય અનુક્રમે ૨.૭૪, ૩.૧૪, ૩.૩૨ છે. જે ૨.૫૮ કરતા વધારે છે. આથી ૦.૦૧ કક્ષાએ આ વ્યક્તિત્વ લક્ષણો માટે જોવા મળતો તરફાવત સાર્થક છે. પરિણામે વ્યક્તિત્વ લક્ષણો આદર કરવો, સહનશીલતા, અને પ્રભૂત્વ માટે શૂન્ય ઉત્કલ્યના H₀₂ નો ૦.૦૧ કક્ષાએ

આસ્તિવકાર કરવામાં આવે છે. આમ, વ્યક્તિત્વ લક્ષ્યો આદર કરવો, સંલગ્નતા અને પ્રભુત્વ, આંતરિક સમજ, સ્વમાન પરિવર્તન, અને સહનશીલતા માટે ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા બિન્નતા હતી.

વ્યક્તિત્વ લક્ષ્યો આંતરિક સમજ, સ્વમાન, પરિવર્તન અને સહનશીલતા માટે સારણી ૧ પરથી સ્પષ્ટ થાય છે કે ધોરણ-૧૨ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓની સરાસરી ઓછી છે. આથી ધોરણ-૧૨ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ આંતરિક સમજ, અવમાન, પરિવર્તન અને સહનશીલતા ધરાવે છે.

વ્યક્તિત્વ લક્ષ્યો આદર કરવો, સંલગ્નતા અને પ્રભુત્વ માટે સારણી ૨ પરથી સ્પષ્ટ થાય છે કે આદર કરવો, પ્રભુત્વ જીવા લક્ષ્યો નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓમાં વધારે જીવા મળે છે. જ્યારે સંલગ્નતાના ગુણો ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓમાં વધારે જીવા મળે છે. નિમ્ન સિદ્ધિ ધરાવતા ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓમાં સંલગ્નતાની ભાવના ઓછી જીવા મળે છે.

આમ, ઉપરોક્ત તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ધોરણ-૧૨ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ સંલગ્નતા આંતરિક સમજ, અવમાન, પરિવર્તન જીવા લક્ષ્યો જીવા મળે છે. જ્યારે ધોરણ-૧૨નાં નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ આદર કરવો, પ્રભુત્વ, સહનશીલતા જીવા મળે છે.

આમ છતા તેમની સરાસરી વચ્ચે જે કોઈ તકાવત જીવા મળે છે તે આડિસ્માં છે. અને આ વિદ્યાર્થીઓની સરાસરી વચ્ચે જે તકાવત જીવા મળે છે તે ૮૫ % વિશ્વાસ સાથે કહી શકાય. આમ, ઉપરોક્ત બાબતો પરથી જગ્ણાય છે કે ધોરણ-૧૧ ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ સંલગ્નતા અને આંતરિક સમજ કેળવવામાં ચઢિયાતા છે.

૮. તારણો

પ્રસ્તુત અભ્યાસના પૃથકરણ પરથી મળેલા તારણો આ મુજબ છે. જેમાં,

૧. ધોરણ-૧૧ના ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના ‘વ્યક્તિગત પસંદગી પ.ક’ માં સંલગ્નતા જીવા ચલોમાં ૦.૦૧ કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા અગ્રેસર ગણાયા હતા. જ્યારે આંતરિક સમજ ચલોમાં ૦.૦૧ કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અગ્રેસર જગ્ણાયા હતા.
૨. ધોરણ-૧૨ના ઉચ્ચ સિદ્ધિ અને નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના ‘વ્યક્તિગત પસંદગી પ.ક’ માં સંલગ્નતા, અવમાન ચલોમાં ૦.૦૧ કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા અગ્રેસર ગણાયા હતા. જ્યારે સ્વાયત્તતા, પ્રભુત્વ જીવા ચલોમાં ૦.૦૧ કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અગ્રેસર જગ્ણાયા હતા. જ્યારે પરિવર્તન ચલોમાં ૦.૦૫ કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા અગ્રેસર ગણાયા હતા. જ્યારે સહનશીલતા ચલોમાં ૦.૦૫ કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતા નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અગ્રેસર ગણાયા હતા.

સંદર્ભસૂચિ

1. Best, J.W. and other, (1986). Research in Education, New Delhi: prentice hall of India P. Ltd.
2. Brown, F.G. (1953). Principle of Educational and psychological testing, (Third Edition), New York, Mott, Rinehart and Winston.
3. Cochran, W.G. (1958). Sampling Techniques, Bombay: Ashiya Publishing House Asian Student edition.
4. દેસાઈ, કે.જી. તથા અન્ય, (૧૯૮૪). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના, અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
5. દેસાઈ, કે.જી. સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ, (દ્વિતીય આવૃત્તિ) અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.